


અરવલ્લી જિલ્લો



- ❖ અરવલ્લી જિલ્લો ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં મહીસાગર, દક્ષિણમાં ખેડા, અને ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાની સરહદો આવેલી છે.
- ❖ આંતરરાજ્ય સરહદ :- રાજસ્થાન
- ❖ સાબરકાંઠા જિલ્લાના અમુક તાલુકા વિભાજીત કરીને નવો અરવલ્લી જિલ્લાની રચના કરવામાં આવી હતી. (પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન)
- ❖ ક્ષેત્રફળ :- ૩,૨૧૭ ચો.કિમી.
- ❖ સ્થાપના :- ૧૫/૮/૨૦૧૩
- ❖ વિવિધ વિષય ની માહિતી અને રેઝ્યુલર ફ્રી ટેસ્ટ, કરંટ અફેર્સ વગેરે માટે આજે જ ડાઉનલોડ કરો Gnan Bhandar મોબાઈલ એપ્લિકેશન
- ❖ વિધાનસભાની કુલ સીટો :- ૩ ભીલોડા (એસ.ટી), બાયડ, મોડાસા
- ❖ વસ્તી :- ૯,૦૮,૭૯૭ (૨૦૧૧ મુજબ)
- ❖ સાક્ષરતા :- ૭૪%
- ❖ સ્ત્રી પુરૂષ પ્રમાણ :- ૯૪૬ (દરહજારે)
- ❖ વસ્તી ગીચતા :- ૨૭૫ એક ચો.કિમી (વ્યક્તિ દીઠ)
- ❖ પીનકોડ નંબર :- ૩૬૫૬૦૧

- ❖ તાલુકાઓ:-૬ (મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ, ભીલોડા અને બાયડ)
- ❖ તાલુકા પંચાયતની કુલ સીટો :- ૬ (બેઠકો-૧૨૮) (મોડાસા-૨૨, ભિલોડા-૨૬, મેઘરજ-૨૨, માલપુર-૧૬, ધનસુરા-૧૮ અને બાયડ-૨૪)
- ❖ જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૩૦
- ❖ નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ :- ૧ મોડાસા-૯(૩૬)
- ❖ ગામડાંઓ :-૬૭૬ (મોડાસા(૧૦૬), માલપુર (૯૯), ધનસુરા (૭૧), મેઘરજ(૧૨૭), ભીલોડા (૧૬૬) અને બાયડ(૧૨૪))
- ❖ ગ્રામ પંચાયત :- ૩૧૮
- ❖ મુખ્ય મથક :- મોડાસા
- ❖ આરટીઓ નંબર:- GJ-33
- ❖ પર્વતો:- અરવલ્લી આરાસુરની પર્વતમાળાઓ
- ❖ નદીઓ :- વાત્રક, મેશ્વો ,માઝમ અને હાથમતી
- ❖ ડેમ :- મેશ્વો ડેમ(શામળાજી) વાત્રક ડેમ (વાત્રક),માઝમ ડેમ(મોડાસા)
- ❖ ધોધ :- ઝાંઝરીનો ધોધ (બાયડ)
- ❖ વાવ :- વણઝારી વાવ (મોડાસા), હીરુવાવ(મોડાસા)
- ❖ કુંડ :- દેસણનો ભુગુકુંડ (ભિલોડા)
- ❖ વિવિધ વિષય ની માહિતી અને રેગ્યુલર ફ્રી ટેસ્ટ, કરંટ અફેર્સ વગેરે માટે આજે જ ડાઉનલોડ કરો
Gnan Bhandar મોબાઈલ એપ્લિકેશન
- ❖ મેળો :- શામળાજીનો મેળો
- ❖ મુખ્ય પાકો :- બાજરી, મકાઈ, કપાસ, એરંડા. ઘઉં, તુવેર અને મગફળી
- ❖ ઉદ્યોગો :- તાંબુ, જસત અને સીસું , જંગલ પેદાશ જેવી કે લાખ, ખેર, મધ, ગૂગળ જેવી પેદાશો
- ❖ ખનીજ :- આરસ પથ્થરો
- ❖ સિંચાઈ યોજના :- માઝમ બંધ, શ્યામ સરોવર બંધ (મેશ્વો નદી) અને હાથમતી બંધ
- ❖ રાષ્ટ્રીય જાણ માર્ગ :- નંબર-૮ (નવો નંબર ૪૮)
- ❖ જોવાલાયક સ્થળો:-, શામળાજીનું મંદિર, દેવાયત પંડિતની સમાધિ, ગેબીનાથ મંદિર ,

વિશેષ નોંધ

- ➔ ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે.
- ➔ વાત્રક નદી રાજસ્થાનના ડુંગરપુર નજીક અરવલ્લી ગિરિમાળામાંથી નીકળી સાબરમતીમાં ભળી જાય છે. એરૂ, માઝમ અને શેઢી વાત્રકની ઉપનદીઓ છે.
- ➔ શામળાજીનું પ્રાચીન નામ ગદાધરપૂરી છે, શામળાજી મંદિર ચૌલુક્ય શૈલી પ્રાચીન શૈલી છે. શામળાજીમાં પ્રખ્યાત વૈષ્ણવ તીર્થ આવેલું છે.
- ➔ શામળાજી ખાતે હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર આવેલું છે.

- ➔ શામળાજી ખાતે કારતક સુદ પુનમે શામળાજીનો મેળો યોજાય છે.
- ➔ મોડાસા પાસે બાજકોટમાં દેવાયત પંડિતની સમાધિસ્થળ આવેલ છે.
- ➔ મોડાસા અને મેઘરજ વચ્ચેથી કર્કવૃત પસાર થાય છે.
- ➔ ગુજરાતમાં અરવલ્લી પર્વતશ્રેણીનું સૌથી ઊંચું શિખર જેસોરની ટેકરીઓ છે. અરવલ્લી શ્રેણીનું સૌથી ઊંચું શિખર ગુરૂશિખર છે જે રાજસ્થાનના આબુમાં આવેલું છે.
- ➔ અરવલ્લી પર્વતમાળા વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે અને તે ધારવાડ સમયનો વિકૃત ખડક છે.
- ➔ વિવિધ વિષય ની માહિતી અને રેઝ્યુલર ફ્રી ટેસ્ટ, કરંટ અફેર્સ વગેરે માટે આજે જ ડાઉનલોડ કરો Gnan Bhandar મોબાઈલ એપ્લિકેશન
- ➔ અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરૂશિખર છે.
- ➔ ગુજરાતમાં મહાત્મા ગાંધીનું સમાધિસ્થળ અરવલ્લીના મહાદેવ બારકોલમાં આવેલ છે.
- ➔ મેશ્વો નદીને કિનારે આવેલ શામળાજી ખાતે દેવ ઉઠી અગિયારસથી આ મેળો યોજાય છે. મેળાનો મુખ્ય દિવસ કારતકસૂદ પુનમ ગણવામાં આવે છે. અહિયાં ‘ કાળિયા બાવજી’ એટલે કે શામળાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર આદિવાસીઓ વિશાળ જનમેદની ઉમટી પડે છે.
- ➔ અરવલ્લી જિલ્લાના ગુજરાત -રાજસ્થાનની સરહદે આવેલ માનગઢ નામની ટેકરીઓ પર ૧૭ નવેમ્બર ૧૯૧૩ના રોજ થયેલ હત્યાકાંડને ગુજરાતનો જલિયાવાળા બાગ હત્યાકાંડ કહેવાય છે. ભીલોના નેતા અને સમાજ સુધારક ગોવિંદ ગુરૂના નેતૃત્વમાં આદિવાસી સ્ત્રી-પુરૂષો એકઠા થયા હતા. આદિવાસી સમાજમાં જાગૃત અને સમૃદ્ધ કરવા માટે ગુરૂ ગોવિંદે ‘ ભગત આંદોલન’ શરૂ કર્યું હતું. ગુરૂથી પ્રેરાઈ આદિવાસીઓ અંગ્રેજોની દમનનીતિનો વિરોધ કરતાં હતા. અંગ્રેજો દ્વારા આ વિસ્તાર ખાલી કરી જતાં રહેવા આદેશ કર્યો ભીલોએ તેનો ઇનકાર કર્યો પરિણામે જેમાં ૧૫૦૦થી વધુ આદિવાસીઓએ અંગ્રેજોએ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. આ હત્યાકાંડનો જવાબદાર અંગ્રેજ બોરો હેમિલટન હતો.
- ❖ વિવિધ વિષય ની માહિતી અને રેઝ્યુલર ફ્રી ટેસ્ટ, કરંટ અફેર્સ વગેરે માટે આજે જ ડાઉનલોડ કરો Gnan Bhandar મોબાઈલ એપ્લિકેશન